

ડાઈક્ટ/FR/૨૦૨૨/૪૫૨-૫૨
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,
અનાવિલ ભવનની સામે, કારેલીબાગ, વડોદરા.
તા. ૧૨/૫/૨૦૨૨

ફી નિયમન સમિતિ - વડોદરા વિભાગ, વડોદરા.

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અનાવિલ ભવનની સામે, કારેલીબાગ, વડોદરા.

Ph.0265-2488487 E.mail add:- frcvadodara@gmail.com

U-Dise-24191 403824.

એફ.આર.સી./વડોદરા/દરખાસ્ત નં. VD-૧૫૨/૨૦૨૧-૨૨.

E-mail : punchpars@gmail.com

તા. ૧૧-૦૫-૨૦૨૨.

અરજદાર શાળા :- ચિન્મય ઇન્ટરનેશનલ સ્કુલ (GSHSEB)(અંગ્રેજી માધ્યમ) ઠે. અણસ્ત રોડ, મું. પો. અણસ્ત, તા. કરજણ, જી. વડોદરા-૩૯૧૨૪૦...

વિષય :- સને-૨૦૨૧-૨૨ થી સને-૨૦૨૩-૨૪ પ્રિ. પ્રાયમરી અને પ્રાયમરીની ફી વધારા માટેની દરખાસ્ત.

અનુસંધાન :-

- (૧) ગુજરાત સ્વનિર્ભર શાળાઓ (ફી નિયમન) અધિનિયમ, સને-૨૦૧૭.
- (૨) ગુજરાત સ્વનિર્ભર શાળા (રેગ્યુલેશન ઓફ ફીઝ) નિયમો, ૨૦૧૭.
- (૩) નામદાર સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં દાખલ થયેલ સ્પેલીવ ટુ અપીલ (સી) નં. ૩૧૪/૨૦૧૮ ના હુકમો.

:- વચગાળાનો હુકમ :-

- (૧) અરજદાર શાળાએ ગુજરાત સ્વનિર્ભર શાળાઓ (ફી નિયમન) અધિનિયમ, સને ૨૦૧૭ અને તે અંતર્ગત ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિયમન (નિયમો) સને-૨૦૧૭ ના નિયમ-૬ અન્વયે ફી નિયમન સમિતિ, વડોદરા સમક્ષ પોતાની દરખાસ્ત રજુ કરી છે. જે દરખાસ્ત તેઓએ સને ૨૦૨૧-૨૨ થી સને ૨૦૨૩-૨૪ ના ૩ વર્ષની ફી નક્કી કરવા માટે જણાવવામાં આવ્યું છે. જેમાં અરજદાર શાળા ધ્વારા નીચે પ્રમાણેની સૂચિત ફીની માગણી કરવામાં આવી છે. :-

અ. નં.	ધોરણ	માધ્યમ	બોર્ડ	અરજદાર શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા. સને ૨૦૧૯-૨૦.	અરજદાર શાળાની સૂચિત ફીની માગણી સને ૨૦૨૧-૨૨.
(૧)	નર્સરી	અંગ્રેજી	GSHSEB	૩૦	રૂ. ૩૪,૦૦૦/-
(૨)	જુ.કે.જી.	અંગ્રેજી	GSHSEB	૨૭	રૂ. ૩૪,૦૦૦/-
(૩)	સી.કે.જી.	અંગ્રેજી	GSHSEB	૪૬	રૂ. ૩૪,૦૦૦/-
(૪)	૧.	અંગ્રેજી	GSHSEB	૫૮	રૂ. ૩૬,૦૦૦/-
(૫)	૨.	અંગ્રેજી	GSHSEB	૪૩	રૂ. ૩૬,૦૦૦/-
(૬)	૩.	અંગ્રેજી	GSHSEB	૩૧	રૂ. ૩૬,૦૦૦/-
(૭)	૪.	અંગ્રેજી	GSHSEB	૩૬	રૂ. ૩૬,૦૦૦/-
(૮)	૫.	અંગ્રેજી	GSHSEB	૨૨	રૂ. ૩૬,૦૦૦/-
(૯)	૬.	અંગ્રેજી	GSHSEB	૨૬	રૂ. ૩૬,૦૦૦/-
(૧૦)	૭.	અંગ્રેજી	GSHSEB	૧૧	રૂ. ૩૬,૦૦૦/-
(૧૧)	૮.	અંગ્રેજી	GSHSEB	૧૩	રૂ. ૩૬,૦૦૦/-
કુલ વિદ્યાર્થી...				૩૪૩	

- (૨) અરજદાર શાળાએ સને ૨૦૧૭-૧૮ થી સને ૨૦૧૯-૨૦ ના વર્ષ માટેની દરખાસ્ત નં. ૪૪/૨૦૧૭ દાખલ કરી હતી. જેમાં નામદાર સુપ્રિમ કોર્ટના સ્પેશીયલ લીવ અપીલ (સીવીલ) નં. ૩૧૪/૨૦૧૮ ફેડરેશન ઓફ સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ અને બીજાઓ વિ. સ્ટેટ ઓફ ગુજરાત દાખલ કરવામાં આવી



હતી. જેમાં વખતોવખત આખરી હુકમ કરવામાં આવેલ છે.

- (૩) અરજદાર શાળાએ સને ૨૦૨૦-૨૧ થી સને ૨૦૨૨-૨૩ ના વર્ષ માટેની દરખાસ્ત દાખલ કરી હતી. જે દરખાસ્ત નં.૪૨/૨૦૨૦-૨૧ થી તા.૦૧-૦૩-૨૦૨૧ ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક-બમશ/૧૨૨૦/૫૩/એફ.આર.સી.સેલ, તા.૦૭-૧૦-૨૦૨૦ ના કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં સ્વ-નિર્ભર શાળાઓએ વસુલવાની થતી ફી બાબતના પરિપત્રને ધ્યાને લઈને સને ૨૦૧૯-૨૦ ના વર્ષમાં જે ફી નક્કી કરવામાં આવી હતી તે ફીના ૭૫ ટકા રકમ સને ૨૦૨૦-૨૧ ના વર્ષમાં ફી તરીકે લેવાની હતી અને તે અન્વયે હુકમ કરવામાં આવ્યો હતો.
- (૪) સમગ્ર દેશમાં તાજેતરમાં ઉપસ્થિત થયેલ કોવિડ-૧૯ ની મહામારીના કારણે તા.૧૬-૦૩-૨૦૨૦ થી રાજ્યની તમામ શાળાઓ (સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ, સ્વ-નિર્ભર) બંધ રાખવાની જાહેરાત કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર ધ્વારા સમયાંતરે લોક-ડાઉનની જાહેરાતો કરવામાં આવેલી હતી તે સંજોગોમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી અને હાલની પરિસ્થિતિમાં પણ કેન્દ્ર સરકારના આ અંગેના નિર્દેશો મુજબ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાના આદેશો કરવામાં આવેલ છે અને આ પરિસ્થિતિ ધ્યાને લઈને અરજદાર શાળાના સને ૨૦૧૯-૨૦ ના ઓડીટ થયેલા હિસાબો અને તે વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે સને ૨૦૨૧-૨૨ થી સને ૨૦૨૩-૨૪ ના ૩ વર્ષ માટેની વચગાળાની ફી, ફી નિયમન સમિતિએ નક્કી કરવાનું ઠરાવેલ છે. કારણ કે, સને ૨૦૨૦-૨૧ ના વર્ષ માટે શાળાએ સને ૨૦૧૯-૨૦ ની ફીના ૭૫ ટકા રકમ જ ફી તરીકે લેવાનું ઠરાવેલ હતું. શાળા પુરેપુરા સમય ચાલી નથી. વિદ્યાર્થીઓની ફી ઓછી આવેલી છે તે જ પ્રમાણે શાળાને પણ ખર્ચનું પ્રમાણ ઓછું થયેલ છે તેથી સને ૨૦૧૯-૨૦ ના વર્ષના ઓડીટ આધારે ફી નક્કી કરવાનું ઠરાવવું ન્યાયી, વ્યાજબી અને શાળા સંચાલક અને વિદ્યાર્થીઓના વાલીઓને નુકશાન ન થાય તે હેતુથી સને ૨૦૧૯-૨૦ નું વર્ષ નક્કી કરવામાં આવ્યું છે.
- (૫) અરજદાર શાળા ધ્વારા સને ૨૦૧૯-૨૦ ના વર્ષના ઓડીટ થયેલા હિસાબો રજુ કરવામાં આવેલા છે અને તેમાં દર્શાવેલી આવક અને જાવકના હિસાબો ફી નિયમન સમિતિ ધ્વારા ધ્યાને લઈને તે વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યાના હિસાબે ફી નક્કી કરવાનું ઠરાવવામાં આવેલ છે. અરજદાર શાળાએ ગુજરાતી માધ્યમ માટેની દરખાસ્ત નં.૧૫૩/૨૦૨૧-૨૨ દાખલ કરેલ છે. બન્ને દરખાસ્તનો સંયુક્ત ઓડીટ રીપોર્ટ રજુ કરેલ છે. જે આધારે બન્ને દરખાસ્તોના સંયુક્ત ઓડીટ રીપોર્ટના ખર્ચાઓ ધ્યાને લઈને ફી નક્કી કરવાનું ઠરાવવામાં આવે છે.



અ.નં.	ફીની વિગત	રકમ
૧	ફીની આવક	રૂ.૧,૪૫,૫૩,૧૮૮/-
૨	કેન્ટીન ખર્ચની ફી	રૂ.૩૫,૬૨,૪૧૦/-
૩	ટ્રાન્સપોર્ટ ખર્ચની ફી	રૂ.૨૫,૨૫,૧૮૮/-
૪	અન્ય આવક	રૂ.૫,૨૬૦/-
૫	અન્ય આવક	રૂ.૫,૮૫૮/-

ક્ર.	ડીસ્કાઉન્ટ	રૂ.૩,૧૫૦/-
	કુલ આવક...	રૂ.૨,૦૬,૧૫,૦૬૪/-
	(બાદ) કેન્ટીન આવક રૂ.૩૫,૬૨,૪૧૦/-	
	ટ્રાન્સપોર્ટ આવક રૂ.૨૫,૨૫,૧૯૮/-	રૂ.૬૦,૮૭,૬૦૮/-
	ચોખ્ખી આવક	રૂ.૧,૪૫,૬૭,૪૫૬/-

- (૬) અરજદાર શાળા તરફથી દર્શાવવામાં આવેલી આવકની વિગતો ચકાસતાં એડમીશન ફી તથા ટર્મ ફીનો સમાવેશ ગુજરાત સ્વ-નિર્ભર શાળાઓ ફી નિયમન અધિનિયમ, સને-૨૦૧૭ ની કલમ-૨ (જી) માં નક્કી કરવામાં આવેલી છે અને તેમાં એડમીશન ફી અને ટર્મ તેમજ અન્ય ફીનો સમાવેશ એક જ ફીના મથાળા હેઠળ કરવામાં આવે છે. અરજદાર શાળાના સને ૨૦૧૯-૨૦ માં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા ૩૪૩ તેમજ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા ૩૫૦ મળી કુલ વિદ્યાર્થીઓ ૬૯૩ થાય છે. અરજદાર શાળાએ એવરેજ ફી રૂ.૨૧,૦૨૧/- પ્રમાણે લીધી છે. જ્યારે એફ.આર.સી. ધ્વારા પાછલા વર્ષમાં નક્કી કરવામાં આવેલી એવરેજ ફી રૂ.૨૫,૫૦૮/- થતી હતી તેના બદલે દરેક વિદ્યાર્થી પાસેથી રૂ.૪,૪૮૮/- ની ઓછી ફી લીધી છે. આમ કરીને અરજદાર શાળાએ રૂ.૩૧,૧૦,૧૮૪/- ની ઓછી આવક મેળવી છે. નામદાર સુપ્રિમ કોર્ટના સ્પેશીયલ લીવ પીટીશન નં.૩૧૪/૨૦૧૮ ના હુકમમાં ઠરાવ્યા મુજબ વૈકલ્પિક પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ સ્વીકારી હોય તો જ વિદ્યાર્થી પાસેથી વૈકલ્પિક પ્રવૃત્તિની ફી અલગથી લેવા હક્કદાર બને છે અને તે સિવાયની અન્ય કોઈ ફી વિદ્યાર્થી પાસેથી અલગ રીતના વસુલ કરવા હક્કદાર બનતા નથી.

ઓડીટ મુજબનો હિસાબ :-

અ. નં.	ખર્ચની વિગત	ઓડીટ મુજબ દર્શાવેલી ખર્ચની રકમ. (રૂ.)	ફી નિયમન સમિતિ ધ્વારા મંજૂર કરેલી રકમ. (રૂ.)	ફી નિયમન સમિતિ ધ્વારા નામંજૂર કરેલી રકમ. (રૂ.)
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
(૧)	એકઝામિનેશન ફી(૧૫૦૦)	૧૬૪૦૫૪૫	૧૦૩૯૫૦૦	૬૦૧૦૪૫
(૨)	પ્રિન્ટીંગ અને સ્ટેશનરી(૧૦૦૦)	૧૩૮૨૦૭૮	૬૬૩૦૦૦	૬૮૯૦૭૮
(૩)	સ્પોર્ટ એક્ટીવીટી (૧૫૦૦)	૧૭૨૩૯૦૦	૧૦૩૯૫૦૦	૬૮૪૪૦૦
(૪)	લોન ઉપરનું વ્યાજ	૨૧૯૬૦૦	૦૦	૨૧૯૬૦૦
(૫)	ઘસારા ખર્ચ	૧૧૮૬૮૫૩	૦૦	૧૧૮૬૮૫૩
(૬)	સરપ્લસ આવક	૨૨૮૪૧૮૭	૦૦	૨૨૮૪૧૮૭
	કુલ રૂ.	૮૪૩૭૧૬૩	૨૭૭૨૦૦૦	૫૬૬૫૧૬૩



- (૭) અરજદાર શાળાએ તેઓના સને ૨૦૧૯-૨૦ ના ઓડીટ રીપોર્ટમાં એકઝામિનેશન ખર્ચ તરીકે રૂ.૧૬,૪૦,૫૪૫/- પ્રિન્ટીંગ અને સ્ટેશનરી ખર્ચ તરીકે રૂ.૧૩,૮૨,૦૭૮/- તેમજ સ્પોર્ટ એક્ટીવીટી ખર્ચ તરીકે રૂ.૧૭,૨૩,૯૦૦/- ની રકમો ઉધારવામાં આવી છે. ફી નિયમન સમિતિ દ્વારા એકઝામિનેશન અને સ્પોર્ટ એક્ટીવીટી અંગે વિદ્યાર્થી દીઠ રૂ.૧૫૦૦/- પ્રમાણે પ્રિન્ટીંગ અને સ્ટેશનરી અંગે વિદ્યાર્થી દીઠ રૂ.૧૦૦૦/- પ્રમાણેનો ખર્ચ ગ્રાહ્ય રાખી બાકીની રકમ અમાન્ય.

કરવામાં આવી છે. અરજદાર શાળા દ્વારા જે ખર્ચ દર્શાવવામાં આવ્યો છે તે વ્યાજબી હોવાનું ફલિત થતું નથી જેથી તેને અમાન્ય કરવામાં આવેલ છે.

(૮) અરજદાર શાળાએ સને ૨૦૧૯-૨૦ ના ઓડીટ રીપોર્ટમાં લોન ઉપરનું વ્યાજ રૂ.૨,૧૯,૬૦૦/- દર્શાવેલ છે. વિદ્યાર્થીની ફીની ગણતરીમાં લોન પરના વ્યાજનો સમાવેશ થઈ શકે નહિ. જેથી, તે રકમ હિસાબમાં મજરે ગણવામાં આવી નથી.

(૯) અરજદાર શાળાએ તેઓના ઓડીટ રીપોર્ટમાં ઘસારા તરીકે રૂ.૧૧,૮૬,૮૫૩/- ખર્ચ તરીકે ઉધારેલ છે. ઘસારો કોઈ પણ પ્રકારનો ખર્ચ ન હોય તેને હિસાબમાં મજરે આપવામાં આવેલ નથી. ફી રીવીઝન કમિટીના વારંવારના ચુકાદાઓમાં ઘસારાને ખર્ચ તરીકે મજરે આપેલ નથી. જેથી તે ખર્ચ અમાન્ય કરવામાં આવેલ છે. અરજદાર શાળાએ ખર્ચ કરતાં વધુ આવક એટલે કે, સરપ્લસ આવક તરીકે રૂ.૨૨,૮૭,૧૮૪/- ની રકમ દર્શાવી છે. જે રકમને વિદ્યાર્થીની ફીની ગણતરીમાં સમાવેશ થઈ શકે નહિ.

(૧૦) અરજદાર શાળાના ઉપર જણાવ્યા ખર્ચા અમાન્ય કરવામાં આવેલા છે તે સિવાયના તમામ ખર્ચા ફી નિયમન સમિતિ ધ્વારા માન્ય રાખવામાં આવેલ છે અને અરજદાર શાળાનો માન્ય ખર્ચ અને વિદ્યાર્થીઓની સંખ્યા ગણતાં નીચે મુજબની વિદ્યાર્થી દીઠની ફી નક્કી કરવાનું ઠરાવવામાં આવે છે.

ઓડીટ મુજબનો હિસાબ :-

તા.૩૧-૦૩-૨૦૨૦ ના ઓડીટ મુજબની કુલ ખર્ચની રકમ		રૂ.૨,૦૬,૫૫,૦૬૪/-
નહિ અપાવેલ ખર્ચ :-		
(૧)	એક્ઝામિનેશન ફી(૧૫૦૦)	૬૦૧૦૪૫
(૨)	પ્રિન્ટીંગ અને સ્ટેશનરી(૧૦૦૦)	૬૮૮૦૭૮
(૩)	સ્પોર્ટ એક્ટીવીટી (૧૫૦૦)	૬૮૪૪૦૦
(૪)	લોન ઉપરનું વ્યાજ	૨૧૯૬૦૦
(૫)	ઘસારા ખર્ચ	૧૧૮૬૮૫૩
(૬)	સરપ્લસ આવક	૨૨૮૪૧૮૭
નહિ અપાવેલ ખર્ચની કુલ રકમ		રૂ.૫૬,૬૫,૧૬૩/-
કુલ માન્ય ખર્ચ		રૂ.૧,૪૯,૮૯,૯૦૧/-
કુલ માન્ય ખર્ચ રૂ.૧,૪૯,૮૯,૯૦૧/- ભાગ્યે ૬૯૩ વિદ્યાર્થી દીઠનો સરેરાશ ખર્ચ		રૂ.૨૧,૬૩૦/-
ડેવલપમેન્ટ ખર્ચની રકમ ૭ ટકા પ્રમાણે		રૂ.૧,૫૧૪/-
આર.ટી.ઇ.ના ૫ ટકા પ્રમાણેના ખર્ચની રકમ		રૂ.૧,૦૮૨/-
કુલ માન્ય ખર્ચ		રૂ.૨૪,૨૨૬/-
સરેરાશ વિદ્યાર્થી દીઠની ફી...		રૂ.૨૫,૦૦૦/-



- (૭) અરજદાર શાળાએ વચગાળાના હુકમથી નારાજ હોય તો તેઓએ દિન-૭ માં ફી નિયમન સમિતિ, વડોદરા સમક્ષ કારણો સહીતની લેખિતમાં રીવ્યુ અરજી કરવાની રહેશે. જો અરજદાર શાળા વચગાળાના હુકમ વિરુદ્ધ નક્કી કરેલી સમય મર્યાદામાં રીવ્યુ અરજી કરવામાં નિષ્ફળ જાય ત્યારે વચગાળાનો કરેલો હુકમ આખરી અને નિર્ણાયક ગણવામાં આવશે.
- (૮) અરજદાર શાળાએ સને ૨૦૨૧-૨૨ ની ફી નિયમન સમિતિ, વડોદરા ધ્વારા નક્કી કરવામાં આવેલી ફી શાળાના નોટીસ બોર્ડ ઉપર તેમજ શાળાની વેબસાઇટ ઉપર અંગ્રેજી તેમજ ગુજરાતીમાં પ્રસિધ્ધ કરવાની રહેશે.

આજ તા.૧૧ માહે મે સને ૨૦૨૨.

સ્થળ :- વડોદરા.

ફી નિયમન સમિતિ વડોદરા વિભાગ, વડોદરાના તા.૧૧/૦૫/૨૦૨૨ ના આદેશાનુસાર



(મુખ્ય સંયોજક)

ફી નિયમન સમિતિ
વડોદરા વિભાગ, વડોદરા.

પ્રતિ, આચાર્ય/સંચાલકશ્રી, ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલ (GSHSEB) (અંગ્રેજી માધ્યમ) ઠે. અણસ્ત રોડ,
મું. પો. અણસ્ત, તા. કરજણ, જી. વડોદરા-૩૯૧૨૪૦...

નકલ રવાના:- મુખ્ય સંયોજકશ્રી, જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વડોદરા તરફ જાણ તથા અમલ થવા
સારું.